

**નિવેદન :**

૧. આંયંબિલનું બોજન જ્યાણપૂર્વક કરવું એઈશે.
૨. પાણી પણ જ્યાણપૂર્વક વાપરવું.
૩. આંયંબિલમાં હી જ - કાળા મરી - સુંધ અને આવાના સોડા, ખલ્ખલા લઈ રહાયા.
૪. એકબાર રસોઈ તેયાર થયા પણી કાચું પાણી કે કાચું ચીંઠું નો ઉપયોગ ન કરશો.
૫. પર્યાયપાણ સેવાનું કે પારવાનું સમયસર કરવું.
૬. કોઈ ભૂલ થઈ હોય તો ગુરુભાઈ / જોગન હોય તો વડીલથી આલોયણા દેવી.
૭. આંયંબિલ રસત્પાગની પ્રલાભના છે.
૮. આંયંબિલશાળામાં પથારાકિં અર્થ / રાકિં ફળો આપો.
૯. દર બેસતે મહિને મંગલિક રૂપે કરાય છે.

આંયંબિલમાં બનાવવામાં આવતી વાનગીઓ અને વિધિ

**અનુકૂળિકા**

- |                             |                           |
|-----------------------------|---------------------------|
| ૧. કીરીઆતું                 | ૧૬. સંગ્રહ ટોકળા          |
| ૨. હીંગમરીનો ઊકાળો          | ૨૦. ખાંડવી                |
| ૩. આખા મજનું પાણી           | ૨૧. પુહલા                 |
| ૪. મજની દાળનું પાણી         | ૨૨. દોસા                  |
| ૫. કઠીણા ચણા અને તેનું પાણી | ૨૩. ઈંદ્રિ                |
| ૬. મિક્સ દાળ                | ૨૪. ચાટણી                 |
| ૭. દૂલી મોગરદાળ             | ૨૫. પનોળી                 |
| ૮. મજની દાળની બાદી          | ૨૬. ઘઉનો ભીચાડે           |
| ૯. ધૂલી                     | ૨૭. મગની ઢોકળી            |
| ૧૦. ચોખાની ઘેસ              | ૨૮. મેથી અને મેથીનું પાણી |
| ૧૧. ભાત                     | ૨૯. પાપડ                  |
| ૧૨. ચોખાની ભીચાડી           | ૩૦. મકાઈની ઘાણી           |
| ૧૩. ડબકા                    | ૩૧. રોકેલા ચણા            |
| ૧૪. તુલેર દાળની દાળ ટોકળી   | ૩૨. ઘઉની રાખ              |
| ૧૫. મેથીની ભાખરી            | ૩૩. ચણા - ઘઉની રોટ્ટી     |
| ૧૬. ચોખાના ગુણીયા           | (ખાખરા - બાદી)            |
| ૧૭. મિક્સ ટોકળા             | ૩૪. ગાંધીયાનું રાક        |
| ૧૮. સેન્દલીય ટોકળા          | ૩૫. ખલ્ખલા                |

**ખાસ:** મીઠાનો ઉપયોગ રહ્યો છે બનાવતા પહેલાં જ કરવો.  
પછીથી કરવો હોય તો બલવણ જ વાપરવું.  
આવશ્યકતા અનુસાર જ વસ્તુઓ લેવી-વાપરવી.

## ૧ કરીઆતું:

**સામગ્રી:** કરીઆતું, પાણી.

**રીત:** તખેલીમાં કરીઆતું રૂભે એ રીતે પ્રમાણસર પાણી કરી જેસ પર ઉકાળો. ઉકાળીને ડાર્યા પછી પાણીને જયણાપૂર્વક ગાળીને ઉપયોગમાં લો.

**ખાસ:** આ પાણી સ્વાસ્થ્ય માટે ધણું જ ઉપયોગી છે.  
આખુંદમાં એનું ધણું જ મહત્વ બતાવેલ છે.  
સ્વાહામાં કડવું પણ ચુશ્ચામાં અતિ ઉત્તમ છે.

## ૨ હીંગ મરીનો ઉકાળો:

**સામગ્રી:** હીંગ મરીનો ભૂકો, સુંધરો ભૂકો, ગીંધુ, પાણી,  
એક તપેલી.

**રીત:** આવશ્યકતા અનુસાર બધી જ વસ્તુઓ બેઝી કરી  
પાણીમાં રૂભેલી રે એ રીતે ચૂલા પર ઉકાળો  
કરો. નીચે ઉતારી નોઈતા પ્રમાણમાં છે એટલે  
ઉપયોગ કરો.

**ખાસ:** આખુંદમાં સ્વાસ્થ્ય બધી તરીકે બતાવેલ છે.

## ૩ આપા મગનું પાણી:

**સામગ્રી:** મગ, પાણી, હીંગ (ચપટી), આવશ્યકતાનુસાર  
ગીંધુ.

**રીત:** યોગ્ય પ્રમાણમાં મગને પાણીમાં રૂભેલા રહે જે  
રીત જેસ પર મગને ચહેલા હો. ચપટી લથ પછી  
ચારણી અથવા મીકસરની મદદથી ગીંધુની નાખો.  
મગનું પાણી ઘણું બનશે. પાણીને બાળી લો પછી  
પાણીમાં પ્રમાણસર ગીંધુ અને હીંગ નાખી  
આવાના ઉપયોગમાં લો.

## ૪ મગની દાળનું પાણી:

**સામગ્રી:** ફેલરાવણી મગની દાળ, પ્રમાણસર ગીંધુ.

**રીત:** ફેલરાવણી દાળને બે કલાક કોડા પાણીમાં  
પલાણી રાખો. પછી એને ધોવાણી ઉપસના ફેલરા  
મીકણી કરો. પછી ઉકાળો. ગીંધાવણા  
પાણીમાં ધોવેલી મગની દાળ નાખી દોયું કરું  
થાતાં ગાળીને પાણી વાપરવું.

## ૫ કઠોળના ચણા અને તેનું પાણી:

**સામગ્રી:** કઠોળના ચણા, પ્રમાણસર ગીંધુ.

**રીત:** ગ્રધમ ચણાને પણી એ કલાક પલાણી રાખવા.  
પછી કુકસ્ની ચાર સીટી ચુંદી બાણ્ણા. કુકરમાં  
મુકતી વખતે જ આવશ્યકતાનુસાર ગીંધુ, થોડા  
આવાના સોડા નાખવા.

કુરમાંથી બહાર કાઢા પછી ચણા અને પાણી  
અલગ કરી દેવા. પાણીમાં પ્રમાણસર (બદલવણ)  
પસુ મીઠું નાખી ઉપયોગ કરવો. ચણાને પણ  
અલગ ઉપયોગ કરવો.

#### ૫ નિકસ દાળ :

સામગ્રી : ચણા દાળ, અડદ દાળ, ભજની ઝેતરાખાળી દાળ,  
તુવેરની દાળ, આવશ્યકતાનુસાર મીઠું.  
રીત : પ્રથમ બધી દાળો ધોઈ નાખવી. પછી બે થી ત્રણ  
કલાક પલાણી રાખવી. ધોગ્ય પ્રમાણમાં મીઠું  
નાખી કુરમાં ત્રણ થી ચાર સીટી પ્રમાણે બાંધવી.  
બરાબર ચરી જાય એટે નીચે ઉતારી ઉપયોગ  
કરવો.

#### ૬ છૂટી મોગરદાળ :

સામગ્રી : મોગરદાળ, પ્રમાણસર મીઠું, પાણી, લીગ.  
રીત : મોગરદાળની એક વાટ્કી દાળ બે વાટ્કી પાણી  
પ્રમાણમાં લેવું. પોંગ્ય સમય પ્રમાણે ચૂલ્હા પર  
બાંધવી. પછી મીઠું અને હીજ પ્રમાણસર નાખી  
ફીની બરાબર ચડવા દેવી.

#### ૭ ભજની દાળની બાટી.

સામગ્રી : ભજની તેથાર દાળ, આવશ્યકતાનુસાર મીઠું,  
લીગ, કાળા મરી.

રીત : ઘઉના આયની બાટી બનાવી ઓવનમાં  
પકાવવી, પછી એના સ્કડા કરી મગની તેથાર  
દાળમાં નાખી, એમાં આવશ્યકતા અનુસાર મીઠું,  
લીગ, કાળામરી નાખી ફીની ચૂલ્હા પર બરાબર  
પકાવવી.

#### ૮ ખૂલી :

સામગ્રી : ઘઉનો રંબો, મોગરદાળ, મીઠું.  
રીત : બે ભાગ ઘઉનો રંબો એક ભાગ મોગરદાળ મીકસ  
કરી ધોઈન ચૂલ્હા પર પ્રમાણસર પાણીમાં પકાવવું.  
પ્રમાણસર મીઠું નાખવું. રંબો અને દાળ એકખીન  
સાથે લેવા થઈ જાય એટાં પકાવવું. બરાબર ઘડ  
થાય એટે ઉતારી લેવી.

#### ૯ ચોખાની બેંસ

સામગ્રી : ચોખા, મીઠું, પાણી.  
રીત : પ્રથમ ચોખાને સારી રીતે ધોઈ, એક વાટ્કી ચોખા  
અને ત્રણ વાટ્કી પાણી પ્રમાણે ચોખાનો દાઢો  
આખો ન હેખાય ત્યાં સુધી પાકવા દેવું. કેમ કેમ  
ઘડ થાય એ નોતા રહેવું પોંગ્ય તેમાર થાય એટે  
મીઠું નાખી થોડી વાર પકાવવું. પછી ઉપયોગમાં  
લેવી.

**૧૧ લાત :**

સામગ્રી : બોખા, ગીંઠુ, પાણી.  
 રીત : બોખાને થોડી - ૧ વાટકી ચોખા, ૩ વાટકી પાણી  
 અને આવશ્યકતાનુસાર મીઠુ. ચૂલ્હા પર પકુવવા.  
 ચડી લાય પછી પાણી વિશેરે લોષ તો ઓસાવી  
 હેણું. કુકરાં પકુવવા મણે નથી સીરી પ્રમાણ  
 પકુવં.

**૧૨ ચોખાની ઘોંખડી :**

સામગ્રી : ૧ વાટકી ચોખા, ૧ વાટકી ગોળદાળ, ગીંઠુ.  
 રીત : બે લેબા કરી થોડી નાખવા પછી અદીગણું પાણી  
 નાખી થોય માત્રાના મીઠુ - કણામરી નાખી  
 બરાબર ચડી લાય ત્યા ચુધી પકુવવી.

**૧૩ ડખા:**

સામગ્રી : અહંકારની દાળ, મગની દાળ, ચોળાની દાળ, ગીંઠુ,  
 હીંગ.

રીત : સરણા લાગે જણે દાળ પદ્ધાળવી પછી લાયવી  
 અથવા પિકસસી મદ્દદી ઘણ પીચવી. પિકાઈ  
 લાય પછી મીઠુ અને હીંગ પ્રમાણસર બરાબર  
 બેણવી હેણું. પછી તેને વડાનો આકાર આપી  
 પાણીમાં ચડાવવા. ત્યારબાદ બીજી તપેલીમાં  
 થોડા પાણીમાં પ્રમાણસર મીઠુ, હીંગ, કણામરી

નાખી હેણગણું. બરાબર ઉકેલે પછી તેમાં પકુનેલ  
 અંકા નાખી હેવા.

**૧૪ તુવેસની દાળની દાળડોડણી :**

સામગ્રી : તુવેસની દાળ, ઘઉની લોટ, ચણાનો લોટ, ગીંઠુ,  
 હીંગ, કણામરી, ફૂડા.  
 રીત : તુવેસની દાળને બરાબર થોડી તેને કુરાગાં બરાબર  
 ચડાવવી. ત્યારબાદ તુવેસની દાળને કેરણીની  
 મહદ્દી બરાબર એકરસ બનાવવી. એમાં મીઠુ,  
 હીંગ અને કણામરી, ફૂડા બેણવવા. પછી તેસ  
 પર હેણગણું. બીજી એક પાત્ર માં ઘઉના લોટમાં  
 થોડો ચણાનો લોટ બેળવી તેમાં પ્રમાણસર  
 મીઠુ-હીંગ નાખવી. પછી લોટની કલાક બાંધી  
 રોટવી કેમ વણી નાના ફૂડા ચાખુની મહદ્દી  
 કરવા. ત્યારબાદ કિણતી તુલસની દાળમાં  
 હણવેણી ફૂડા નાખી તેને ઢાંઢી કરી પાંચ મિનિટ  
 ચુધી ઉંઠાં.

**૧૫ મેથીની લાખરી :**

સામગ્રી : ઘઉનો લોટ, ચણાનો લોટ, મેથી પાવડર, મીઠુ,  
 અને હીંગ.  
 રીત : ઘઉનો લોટ થોડો ચણાનો લોટ આયે થોડેં  
 મેથીનો લોટ (પાવડર) મીકસ કરવો પછી તેમાં  
 મીઠુ અને હીંગ પ્રમાણસર નાખવા પછી કણામરી

નેમ કથા ભાંધવા. પછી વણીને ભાજી  
બનાવવી.

#### ૧૬. ચોખાના મુકીયા:

**સામગ્રી :** ચોખા-ઘઉનો લોટ, ચણાનો લોટ, બાજરીનો  
લોટ, ભીંડુ-હીંગ, આવાના સોડા.

**રીત :** પ્રથમ ચોખાને મૂરેપૂરા ચડાવવા. પછી ૧ વાદળી  
બાલ, બરાબર અઠવી વાડળી ઘઉનો લોટ, અઠવી  
વાડળી ચણાનો લોટ, અઠવી વાડળી બાજરીનો  
લોટ તેમાં ભીંડુ - હીંગ - કાળાભરી ભૂલ્હો,  
આવાના સોડા પ્રમાણસર નાખી કશાઈ-નેમ  
બાંધી એના મુકીયા બનાવવા પછી ઘેકળાની  
નેમ ચડાવવા.

#### ૧૭. મિક્સ ટોકણા:

**સામગ્રી :** પણાની દાળ (૧ ભાગ), અડણી દાળ (૨  
ભાગ), મગની દાળ (૧ ભાગ), તુલેસની દાળ (૧  
ભાગ), ચોખા (૧ ભાગ), ચોખાની દાળ (૧  
ભાગ), ભીંડુ, હીંગ, આવાના સોડા.

**રીત :** ઉપર જાણેલ બધી દાળને પણાની બરાબર  
પણાની જમ એટે તેને મિક્સમાં ઘડ પીસવી.  
ત્યારબાદ પ્રમાણસર ભીંડુ, હીંગ, કાળાભરી,  
આવાના સોડા નાખી થાળીમાં ઝેવાની ટોકણા  
બનાવવા.

#### ૧૮. સેન્ટવીચ ટોકણા:

**સામગ્રી :** ચોખા (૩ ભાગ), અડણી દાળ (૧ ભાગ),  
કઠોળના લીલા વયાણા, ભીંડુ, હીંગ, કાળાભરી.

**રીત :** પ્રથમ ચોખા અને અડણી દાળ ઘડ પીસી લેવા.  
પછી ઘોઉં પાણી નાખી આથી દેવું. લગભગ  
ત્યા-ચાર કલાકમાં આથો આવી કરો. ત્યારબાદ  
કઠોળના લીલાં વયાણાને પીસી નાખવા. તેને  
થોડા ભીરાગાં ભીકસ કરી દેવું. સેન્ટવીચ ટોકણા  
બનાવવા માટે પહેલી થાળીમાં ઘોઉં ભીંડુ નાખી  
તેને પકાવી દેવું. પછી તેને બહાર કાઢી  
વયાણાવાનું ભીંડુ ઉપર નાખી ફરીથી પકાવવું.  
પછી તેને બહાર કાઢી ભીરાનું થર ફરીથી પાથરવું  
અને ફરીથી પકાવવું. બરાબર ચડી જમ એટે  
બહાર કાઢી ઘોંય ભાપના ટૂંકા કરવા.

#### ૧૯. સંંબંધ ટોકણા:

**સામગ્રી :** ચોખા (૩ ભાગ), અડણી દાળ (૧ ભાગ),  
મગની સેતરાવાળી દાળ (૧ ભાગ), કઠોળના  
લીલા વયાણા, રીતેલા ચણા, ભીંડુ, હીંગ.

**રીત :** ચોખા અને અડણી દાળનો થોડો બડો લોટ  
પીસી લેવો. પછી પાણીમાં આથી દેવું. મગની  
સેતરાવાળી દાળ પણાનીને ઘડ પીસી લેવું. તેમાં  
ભીંડુ, હીંગ, કાળાભરી પ્રમાણસર નાખવા. પછી  
ચોખા અને અડણી દાળના ભીરાને નાની

વાડકીએં નાખવું. ત્યારબાદ તેના ઉપર ભગની સેતરાવાળી દાળનું ખીંચું પાથરવું, પછી તેની ઉપર ફોળના વિશેષ અને રોકેલા અણા કણાવવા. ટોકળાની માફક તેને પકાવવા. દાળનીયાની ચઠ્ઠી સાથે આબામાં ઉપયોગ દેવો.

## ૨૦ ખાડવી :

સામગ્રી : ચણાનો લોટ, મીઠુ, હીંગ, કાળામરી.  
 રીત : ૧ વાટકી ચણાનો લોટ, ૨.૫૦ વાટકી પાણી બરાબર ગીકસ કરવું પછી તેમાં પ્રગાણસર મીઠુ, કાળામરી નાખી ચૂલ્સા પર પદ્ધતિ ગરની આપતાં ખૂબ હલાવતા રહેણું નેથી ગાંઠીયા ન થઈ જય. બરાબર ઘણું થાય એટલે ઉતારીને થાળી પર પાથરી ઢેવું. કૃતી જય એટે ગોળ પાતરાની માફક રીત બનાવવો. પછી પ્રગાણસર કાપી દેવા. ચોળના લોટવી ખાડવી પણ આજ રીતે બનાવી શકાય.

## ૨૧ પૂર્ણા :

સામગ્રી : ચણાનો લોટ, મીઠુ, હીંગ, કાળામરી.  
 રીત : ચણાના લોટમાં પાણી જોળવી ખીંચું તેપાર કરવું પછી તેમાં પ્રગાણસર મીઠુ, હીંગ, કાળામરી નાખવા. ખીંચું બજું ઘણ નહિં કે પતદું નહિં એણું રાખવું જોઈએ. જેસ પર તથી બરાબર ગરમ જયા

પણી ચોમચાની મહદ્દી તથી પર જોની કે એટલા પાતળા પઢમાં પાથરવી. બે ભીનીટ પછી ઉથલાવી પ્રગાણમાં લાલારા થાય ત્યાં સુદી પકાવવું.

ભગની દાળ, ચોળાની દાળના પૂર્ણા પણ આ રીતે જ બનાવાય.

## ૨૨ ડોસા :

સામગ્રી : ચોમા ઉ વાટકી, અડદની દાળ ૧ વાટકી, મીઠુ, હીંગ.  
 રીત : ચોમા અને અડદની દાળનું ખીંચું તેપાર કરવું. તેમાં પ્રગાણસર મીઠુ, હીંગ નાખી નહિં ઘણ નહિં પાતળું એણું ખીંચું પૂર્ણાની માફક જ પકાવવું. (પણ ઉથલાવવું નહિં).

## ૨૩ ડિલી :

સામગ્રી : ચોમા ઉ જાગ, અડદની દાળ ૧ જાગ, મીઠુ, હીંગ.  
 રીત : ચોમા અને અડદની દાળને બે કી જાણ હલાક પલાળી રાખી આધો આવી જાય એટલે ખીંચું તેપાર કરવું, પછી પ્રગાણસર ખીંચું અને હીંગ ગીકસ કરવું. પ્રગાણમાં ઘણ ખીંચું ડિલીના સેનદા અથવા વાટકીએં ટોકળાની માફક પકાવવું રાગમણે ૧૦ મિનિટમાં કરી જાય એટલે બહાર કાઢવા.

## ૨૪ ચટણી :

સામગ્રી : દાળિયા (શેકેલા), મીઠુ, કાળામરી.

રીત : શેકેલા દાળિયાને અધકચરા વાટી નાખવા. પછી પ્રમાણસર ઉકાળેલા પાણીમાં ભૂંકો મીકસ કરી રેમાં મીઠુ, કાળામરી નાખી હલાવવું. ચટણી ઘડ બનાવવી.

## ૨૫ પનોળી :

સાખ્યા : મગની દાળ અથવા ચોળાની દાળ, મીઠુ, મરી.

રીત : બેમાંથી કોઈપણ દાળ જ થી ર કલાક પાણીમાં પલાળવી. પછી પીચીને જીંદું બનાવવું. ઘડ પીરામાં મીઠુ, હીંગ, કાળામરી ઝૂલા બરાબર મેળવી હેવા. ત્યારબાદ મૌદી તપેલીમાં ર ગલાસ જેટંદું પાણી લેવું આ પાણીને ઉકાળવું. તપેલીને વંધબેસતી તાસક પર જીંદું પાથરી તપેલીમાં અંદરની બાજુ લટક્યું રહે એ રીતે તાસક ગોકળી હેવી. પાણીની વગળથી જ થી ર મિનિટમાં પનોળી બંકાઈ જરો. પછી સાખ્યાને તાસક ઉપાડી લેવી તપેલાથી પનોળી ઉચ્ચારી લેવી.

## ૨૬ ઘઉંનો ખીચડો :

સામગ્રી : ઘઉં, તુવેરની દાળ.

રીત : આખા ઘઉં પર બરમ પાણી છાંઠી એને છાલ

મીકળી જાય એ રીતે ફૂલવા. પછી તજ્જામાં સુકળી દેવા. પછી ઘઉંને પહેલાં ચડાવવા. પછી રેમાં તુવેરની દાળ નાખી ફીલી એટલું ચડાવો તે દાળ ઓકદમ ગળી જાય. ત્યારબાદ મીઠુ અને મરીના દાણા નાખી ચડાવ્યું. બીચડી જેંબ તેયાર થાય એટલે નીચે ઉતારી લેવું.

## ૨૭ મગની ટોકળી :

સામગ્રી : મગ, ઘઉં નો લોટ, ચણાનો લોટ, મીઠુ, હીંગ, કાળામરી.

રીત : મગમાં બધારે પાણી નાખી પહેલાં ચડાવી લો. પછી રેમાં પ્રમાણસર મીઠુ, હીંગ, કાળામરી નાખી ઉકાળો. પછી ઘઉના લોટમાં થોડો ચણાનો લોટ નાખી રૂક્ક કણકની જેંબ બાંધી નાની દીકડીઓ બનાવો. ઉકળતા મગના પાણીમાં સાખ્યાને એડિસાથે દીકડીઓ ઉમેરી દો. બરાબર ચડી જાય એટલે ઉતારી લો.

## ૨૮ મેથી અને મેથીનું પાણી :

મેથીને પાણીમાં ઉકાળી મેથી અને પાણી અલગ અલગ ઉપયોગમાં લો.

## ૨૯ પાયુઃ :

સામગ્રી : મગની મોગરદાળ (૨ ભાગ), અડણી દાળ (૧ ભાગ), હીંગ, મીઠુ, કાળામરી, ખાબાના સોડા.

**શીત :** બન્ને દાળના પીસેલા લોટમાં હીંગ, ગીંધુ, કાળામરી, આવાના સોડા મિક્સ કરો. પછી ઉકાળેલા પાણીથી લોટને એકદમ ઘણ બાંધો. પછી લોટને મુલાયમ થઈ નાચ એટ્યો ફૂટો. પછી તેના ગુલ્સા બનાવો. આંદખિલના પાપડ હોવાથી તેલનો ઉપયોગ બીજાકુલ કરવો નહિં. જરૂર પડે તો લોટનો જ ઉપયોગ કરીને વણાયું. પછી સૂકાય એટ્યે ગરમ ભર્હી પર પાપડ સેકવા. ગુલ્સા પણ વાપરી શકાય છે.

### ૩૦ મકાઈની ધાણી :

**સાંખ્યી :** મકાઈ, ગીંધુ, કાઠાઈ, ચારણી.

**શીત :** લોઅંડની કડાઈમાં ગીંધુ વધારે પ્રમાણમાં નાખી બરાબર ગરમ થઈ નાચ એટ્યે એમાં મકાઈ (સુફી) નાખો. બરાબર હુલાવતા રહો એટ્યે થોડી વારમાં મકાઈ કૂચો અને ધાણી તેથાર થરો. ધાણી કૂરી નાચ એટ્યે ચાળીને કાઢી લો. નુંવારની ધાણી પણ એજ રીતે ભનાવી શકાય.

### ૩૧ રોડેલા ચણા :

**સાંખ્યી :** ચણા, ગીંધુ.

**શીત :** ગીંધાના પાણીમાં ચણા પલાણી બરાબર પલણી નાચ પછી કોથળા પર સુકળી હો. પછી કડાઈમાં બાલુ (રેતી) ગરમ કરો બરાબર ગરમ થાય પછી

ચણા એમાં નાખી હુલાવતા રહો. ચણા બરાબર શેકાઈ નાચ એટ્યે ચાળી લો.

### ૩૨ ઘઉની રાબ્ય :

ઘઉના લોટને તવા પર લાલાસા પઢતો ગોકી લેવો. પછી તેમાં પ્રમાણસર સુંઠ પાવહર અને ગીંધુ નાખી પાણીમાં નાખી ઉકળી બરાબર ઉકળે એટ્યે નીચે ઉતારી લો.

### ૩૩ ચણાની/ઘઉની શેટલી :

**શૈલી - આખરા - બાટી વળે સામાન્ય ગૃહિણી જણાતી હોવાથી રીત નથી બલાવી.**

### ૩૪ આંદીયાનું શાક :

ચણાના લોટમાં ગીંધુ, હીંગ, કાળામરી પ્રમાણસર લઈ પાણીમાં કદ્દ કણક બનાવી. નાની નાની વેલ બનાવી નાના કૂદા ક્રી ઉકળતા પાણીમાં પકાવવા. પછી તપેલીમાં થોડે ચણાનો લોટ નાખવો નેથી પ્રમાણસર ઘણ રહે.

### ૩૫ બલવણી :

ચીડાને માટીના વાસણામાં ભરી એમાં ગીંધુ પાણી નાખો. પ્રમાણમાં વધારે ગરમ કરવાથી પાણી બળી કરો અને બલવણ તેથાર થરો.

**આંદખિલમાં મસાલા :** (૧) પાંદુ ગીંધુ (૨) સિંધાદૂષ (૩) બિહલવણ (૪) સંચળ (૫) હીંગ (૬) સુંઠ (૭) મરી (૮) કરિયાતાનું પાણી (૯) અણાલારી વસ્તુઓ.